



RAN-2401001202050002

F.Y.B.A. (Sem.-II) Examination November - 2025

Gujarati Proficiency and Life Skills - II

Gujarati Bhasha Saamarthy Ane Jivan Kaushal (AEC - II)

Time: 1 Hours]

[Total Marks: 25

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. ટૂંકા પ્રશ્નોના જવાબ આપો. (કોઈ પણ પાંચ)

10

1. કોશના પ્રકાર કેટલા અને ક્યા ક્યા?
2. કોશના બે ઉપયોગો જણાવો.
3. રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન કયું છે?
4. ગદ્યખંડના પ્રશ્નોના જવાબ કઈ રીતે શોધી શકાય?
5. રૂઢિપ્રયોગની ઉપયોગિતા કઈ છે? જણાવો.
6. ગદ્યખંડને અનુરૂપ શીર્ષક આપવાનું હોય તો શીર્ષક કેવું હોવું જોઈએ.
7. કહેવત એટલે શું? એનો અર્થ સમજાવો.

પ્ર.2. અ. કોઈ પણ પાંચ રૂઢિપ્રયોગના અર્થ આપી સમજાવો.

05

- | | |
|----------------------------|-------------------------|
| 1. એક નજર થવી | 6. ખાણખોદ કરવું. |
| 2. ઘી ને ઠામ ઘી પડી રહેવું | 7. ઈડરિયો ગઢ જીતવો. |
| 3. દિવાસળી ચાંપવી | 8. ધોયેલા મૂળા જેવા |
| 4. તણખા ઝરવા | 9. દહીં દૂધમાં પગ રાખવો |
| 5. કાગારોળ કરવું | 10. ચૌદ ભુવન એક થવા |

બ. કોઈ પણ પાંચ કહેવતો અર્થ આપી સમજાવો.

05

- | | |
|----------------------------|----------------------------|
| 1. ખાડો ખોદે તે પડે | 6. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ |
| 2. ઉતાવળે આંબા ન પાકે | 7. વાતનું વતેસર કરવું |
| 3. ચેતતા નર સદા સુખી | 8. સોના કરતા ઘડામણ મોંઘુ |
| 4. દોરડી બળે પણ વળ ન છોડે | 9. અણી ચૂક્યો સો વરસ જીવે |
| 5. કુમળું ઝાડ વાળીએ એમ વળે | 10. તરણા ઓથે ડુંગર |

અથવા

નીચે આપેલ ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ લખો.

આપણે માણસ છીએ તે કેવળ આપણી ક્ષુદ્ર વાસના ને ઈચ્છાઓ પૂરી કરીને પોતાના દેહને સુખી કરવા માટે નથી, પણ માનવધર્મથી વર્તીને બધાને સુખી થયેલા જોવા માટે છે. એટલા માટે જ આપણે નિર્દોષ અને ગુણસંપન્ન થવાની જરૂર છે. નિર્દોષતા વગર સદ્ગુણોનો પ્રભાવ પડતો નથી. સદ્ગુણી એનો અર્થ જ એ કે બીજાઓ સાથે સમરસ થઈને તેમના સુખદુઃખનો વિચાર કરવો, પોતે દુઃખ અને મુસીબતો સહન કરીને બીજાઓને સુખી કરવાનો પ્રયત્ન કરવો, તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું. આમ કરવાથી જ આપણા આત્મભાવોનો વિકાસ થાય છે. કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં બીજાઓ સાથે આપણો સંબંધ થાય ત્યાં ત્યાં આપણા સદ્ગુણોને કારણે આપણો આત્મભાવ વિકસિત થતો રહેવો જોઈએ. તે આત્મભાવમાં જ સુખનો ભંડાર છે. માનવજીવન આ સર્વશ્રેષ્ઠ સુખ માટે છે. આમાં જ માણસની પરમોત્તતિ છે.

કેદારનાથ

પ્રશ્નો :

1. આપણે નિર્દોષ અને ગુણસંપન્ન થવાની આવશ્યકતા શા કારણે છે?
2. સદ્ગુણી કેવી રીતે થઈ શકાય?
3. સદ્ગુણો કેળવવાથી શો લાભ થાય છે?
4. સમજાવો : ‘આત્મભાવમાં જ સુખનો ભંડાર રહેલો છે’
5. લેખકની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ સુખ શેમાં સમાયેલું છે? શાથી?